



જનસંપર્ક અધિકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૭/૦૨/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૪ કેસ કરી, ૪૯ વ્યક્તિઓને ઝડપી, ૮૮ લીટર દેશી દારૂ, ૬૦૭ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૪ બિયર ટીન, ૨ કાર અને ૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૩ કેસ કરી, ૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૧,૯૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૪૬/૧૯

માધવપુરા: દિપક બનવારીલાલ પાન્ડે (ઉ.વ.૫૫) (રહે. પંચગીની રેસીડન્સી ન્યુ નરોડા પાર્શ્વનાથ ટાઉનશીપ રોડ કૃષ્ણનગર નરોડા) દિપક પાન્ડે કર્ણાવતી રેલ લોજીસ્ટીક ઇ/૭-સીટી સેન્ટર ઇદગાહ સર્કલ ખાતે ટ્રાન્સપોર્ટ બ્રોકરનો ધંધો કરતા હોય તા.૩/૨/૧૯ સાજના ૭/૦૦ થી તા.૬/૨/૧૯ બપોરના ૩/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન આરોપી વિજયકુમારે દિપકભાઈને ફોન કરી વિશ્વાસમાં લઈ તેમના ખાતામાંથી રૂપિયા ૬૦,૦૦૦/- ટ્રક ભાડા પેટે પોતાના ખાતામાં જમા કરાવડાવી તે મેળવી લઈ ફોન બંધ કરી રૂપિયા ૨,૦૦,૦૦૦ જતા કરવાની માગણી કરી દિપક પાન્ડે સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ અંગે દિપક પાન્ડેએ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.ડી.બારોટ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૪૭/૧૯

ગાયકવાડ હવેલી: આસીફભાઈ હકીમુદીન ઝાબુઆવાલા (રહે. ફીરદોષ ફ્લેટ બી.એમ.સી. બેંક સામે ખાનપુર) એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૫/૨/૧૯ સાજના ૫/૩૦ વાગ્યાના સુમારે જમાલપુર એ.પી.એમ.સી.માર્કેટ સારથી એગ્રો કોર્પોરેશન દુકાન નંબર-૨૧ ખાતે ખેતીવાડીના સાધનો ખરદી કરવા માટે આવેલ બે પુરૂષ આસીફભાઈની નજર ચુકવી દુકાનની અંદર કેસ કાઉન્ટરની નીચેથી રોકડ રૂપિયા આશરે ૭૦,૦૦૦/- સાથેનું પર્સ ચોરી કરી લઈ જતા રહ્યા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ બી.એ.ચાવડા ચલાવે છે.

### લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૨૪૮/૧૯

સોલા હાઇકોર્ટ: વિમળાબહેન વા/ઓ ખુબચંદભાઈ પંડ્યા (ઉ.વ.૪૬)(રહે.રોયલ એલીગન્સ બંગ્લોઝ એચ.એલ.પટેલ બંગ્લાની બાજુમાં સુપર સીટી ન્યુ ટી.પી.રોડ ભાડજ) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૫/૦૨/૧૯ કલાક ૫/૩૦ વાગ્યાના સુમારે પોતાના મકાનના દરવાજાની પાસેની બારી ખોલી બારીમાંથી હાથ નાખી દરવાજાનું તાળુક ખોલી બે પુરૂષો ઘરમાં પ્રવેશ કરી એક પુરૂષે વિમળાબહેનનું મોઢું દબાવી રાખી, માથામાં ઇજા કરી બીજા પુરૂષે લાકડાના કબાટમાંથી રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- અને પર્સમાંથી રોકડ રૂપિયા ૮,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૩,૦૦૦/- મતાની લુંટ કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.જે.હુણ ચલાવે છે.

સરદારનગર: પોપટલાલ રૂપચંદભાઈ ચાવડા (ઉ.વ.૬૪) (રહે. ડી વોર્ડ કુબેરનગર સરદારનગર) તા.૫/૨/૧૯ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે કુબેરનગર સતરામ માર્કેટની ગલી નજીકથી પત્ની જમનાબહેન સાથે ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ પોપટલાલ ચાવડાના પત્ની જમનાબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લુંટ કરી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ પોપટલાલ ચાવડાએ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જે.સી.શેખ ચલાવે છે.

### વાહન અકસ્માતમાં મત્યુ:-

સમાચાર યાદી નં.૨૪૯/૧૯

“કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન: શાહનવાઝ મુસ્તાકહુશેન શેખ (રહે. અલબદર પાર્ક ટેનામેન્ટ સદાની ધાબી કેનાલ પાસે વટવા) એ “કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૬/૦૨/૧૯ બપોરના ૩/૩૦ વાગ્યાના સુમારે શાહનવાઝ શેખ અને તેમનો નાનો ભાઈ શાહવલી શેખ (ઉ.વ.૨૮) નારોલ વટવા રોડ હુન્ડાઈ શો રૂમ નજીકથી મોટર સાયકલ ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા મોટર સાયકલના ચાલકે મોટર સાયકલ પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ટક્કર મારતા શાહવલી શેખને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૭/૨/૧૯ કલાક ૨/૨૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જી.જે.રાઓલ ચલાવે છે.

### આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૫૦/૧૯

ઇસનપુર: કંકુબહેન વા/ઓ રમેશભાઈ (ઉ.વ.૫૦) (રહે.નિલગીરીના છાપરાં દશામાના મંદિર પાસે ચંડોળા તળાવ ઇસનપુર) એ અગમ્ય કારણસર તા.૫/૨/૧૯ રાતના ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે લાકડાની વળી સાથે પ્લાસ્ટીકની પાટી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઇસનપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.ચાવડા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.